

LL.B. Semester - 1 (CBCS) Examination
February-2025 (As Per Syllabus Year July - 2018)
BANKING LAW(CORE/ELECTIVE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ ભારતમાં સહકારી બેંકોનું માળખું અને તેનું મહત્વ જણાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ રિઝર્વ બેન્કના કોઈ પણ ત્રણ મહત્વના કાર્યો જણાવો.
- પ્રશ્ન-૨ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનું મહત્વ અને લક્ષણો સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ વિનિમયપત્ર એટલે શું? વિનિમયપત્ર અને વચનચિકી વચ્ચેનો તફાવત સમજાવો.
- પ્રશ્ન-૩ ભારતમાં બેંકિંગ સંસ્થાઓનો વિકાસ સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ ચેક એટલે શું? ચેકની ચુકવણી તેમજ ચેક ક્યારે રદ થાય તે સમજાવો.
- પ્રશ્ન-૪ ધારણ કરનાર અને યથાનુક્રમે ધારણ કરનારના હકો જણાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ બેંકર અને ગ્રાહક વચ્ચેના સંબંધ સામાન્ય લેણદાર અને દેવાદારના સંબંધોથી કઈ રીતે જુદા પડે છે? તે સમજાવો.
- પ્રશ્ન-૫ આપેલ પૈકી કોઈ બે વિષે ટૂંકનોંધ લખો. (૧૪)
 (1) બેલેન્કિંગ લોકપાલ (3) ચેકના પ્રકારો
 (2) કોર્સિંગના પ્રકારો (4) પરિપક્વતા અને છૂટના દિવસો

ENGLISH VERSION

- Que-1 State the structure and importance of co-operative banks in India. (14)
OR
- Que-1 State any three important functions of the Reserve Bank.
- Que-2 What is a Negotiable Instrument? Explain the importance and features of a negotiable instrument. (14)
OR
- Que-2 What is a bill of exchange? Explain the difference between promissory note and promissory note.
- Que-3 Explain the development of banking institutions in India. (14)
OR
- Que-3 What is a check? Explain the payment of the check as well as when the check is cancelled?
- Que-4 State the rights of the holder and holder respectively. (14)
OR
- Que-4 Explain how the relationship between a banker and a customer differs from that of an ordinary creditor and debtor.
- Que-5 Write any two short notes from the following: (14)
 (1) Banking Ombudsman (3) Types of Checks
 (2) Types of crossing (4) Maturity and days off
